https://archive.org/details/bk1045/page/n0/mode/1up
-Anandpar -Atrocities by Pirana Satpanthis (1045)
All Items on https://archive.org/details/realpatidar
Full Library on https://realpatidar.com/library

KJ-BK-3-15

૨૦૦૧ ના ફાગણ શુદ ૯ ને બુધવાર ના રોજ ગામ શ્રી આંનદપર મુકામે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ના ૧ મોહરૂ જેઠા મનજી જેઓ આ આંનદપર ના રહેવાસી [illegible] [illegible] મોટે જે પીરાણા ધર્મ પાળનાર [illegible] [illegible] [illegible] [illegible] [illegible] કરેલ કે ઉપાસ [illegible] તેવુ હતુ જે હીન્દુ ધર્મ પાળનાર કોઈ [illegible] [illegible] મોટે પણ [illegible] કરવુ છોડી [illegible] પડી છે [illegible] જે પીરાણા ધર્મ પાળનાર જો ન [illegible] તો [illegible] કચ્છમાં રહી શકીએ તેમ નથી તેવુ [illegible] હતુ તે [illegible] આ વાતને [illegible] માટે શુ ઉપાય કરવા જે [illegible] નકી થયુ જે [illegible] શ્રીમાન [illegible] સાધુ [illegible] ના [illegible] તેમના જે [illegible] નહી થાય તેમ નહી કરવુ. તે [illegible] [illegible] શ્રીમાન [illegible] રતનશી [illegible] થયુ [illegible] [illegible] શ્રીમાન [illegible] [illegible] હકીકત [illegible] હકીકત કહી [illegible] જે [illegible] નહી થયુ જે આ [illegible] હકીકતને [illegible] [illegible] નહી થયુ.

૧ આ ગામ હકીકત માટે હીન્દુ ધર્મ [illegible] શકાય તે માટે કચ્છના મહારાઓશ્રીને મળી ને ધર્મ રક્ષા મેળવવા.

૨ [illegible] [illegible] [illegible] [illegible] [illegible] છે તે [illegible] [illegible] મંડળ ના [illegible] કરીને [illegible]

૩ [illegible] [illegible] [illegible] નહી [illegible]

ઉપર મુજબ [illegible] [illegible] નહી [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1045/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1045/page/n2/mode/1up

-Anandpar -Atrocities by Pirana Satpanthis (1045)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.20 16:28:33 +05'30'

VSA: 11-Jul-1945
Date recorded as per Kutchi calendar in which year changes in Ashad month

KJ-BK-3-15

realpatidar.com

સં. ૨૦૦૧ ના અષાડ શુદ ૧ ને બુધવાર ના રોજ ગામ શ્રી આણંદપર ગામે શ્રી કચ્છ
કડવા પાટીદાર સમાજ ના ૧ જાહેર જનરલ મીટીંગ જેમાં આ આણંદપર ના સનાતની લોકોએ
ઉપર ધર્મ પાળવા માટે જે પીરાણા ધર્મ પાળનાર લોકોએ જે જે કારણ આરોપ મુકી
વર્ણન કરેલું વર્ણન કરેલ છે કે કપાસી ઉઠ્યું તેવું હતું જે હીંદુ ધર્મ પાળનાર કોઈ રીતે
પોતાનું આબરૂપણું માટે પણ આજે ઉપર કચ્છ છોડી બધા દેશ જઈ પડી છે ન આ રીતે
જો પીરાણા ધર્મ પાળનાર જો ન જોઈ તો કોઈ રીતે કચ્છ આપણે કચ્છમાં રહી શકીયે તેમ
નથી તેવું જણાય આવતું હતું તે બાદ આ વાતનો નીર્ણય લાવવા માટે શું ઉપાય
કરવા જે ગણતરી ઘણી વાર ગણી નહી થયું જે લગ્નવહેવાર શામ ને લિમાન પુરતું સાધુ
આપણીરાણા ના શાખા માટે તેમના જે શકા નહી થાય તેમ નહી કરવું.
તે પ્રમાણે મુજબ આજ થયો તો મુની વિરાજનવાળા લિમાન તથા રતનશી ભાઈ
વા લીધું વાળજી જો ખરા કુળ વગર ખાટાપ કહેવા તે લિમાન થયું મહારાજ
શ્રી પાસે માત્ર હકીકત લાગતવાર હકીકત કહી સાંભળાવેલ જે ઉતરવા નહી થયું જે
આ સમાજ ના હકીકતનો કંઈ નીર્ણય લાવવા તેના મને મુકરર નહી થયું.

૧ આ, માત્ર હકીકત માટે હીંદુ ધર્મ કેમ ટકાવી શકાય તે માટે કચ્છના મહારાજશ્રીને
મળવા ને ધર્મ રક્ષા મેળવવા.

૨ લોકોએ રાખેલ મુકરર જાતના ઉમેદવારો જાહેર તેમ આજુબાજુ કપડવંજ તથા બીજે
જે જે બાબત છે તે માત્ર જાળવવા કરવા ખાતરીથી શોધવા ને તેમાં ૧ પ્રકારની
મંડળ ના નામથી તેમને કચ્છમાં રજીસ્ટર કરાવવા આપવું નક્કી.

૩ એ માતાજી ના ઉપાડેલ માં તથા તેમાં જે સ્થાને સાચવવા તરીકે જરૂરી પુરતા બનાવવા જેમાં
કુળના બાળકો માટે રહેવા આ જગ્યા પુરતું પરવાનગી કરવી ને બાદ મુકરર
કરી મેળવવા જેમ નહી નકી લાવવા.

ઉપર મુજબ નક્કી લાવવા માટે જે શાખના મુખ્ય હોદ્દેદારોની સમક્ષ શામ
બોલાવવા તેમ નહી રાખવું.

realpatidar.com